

પ્રશ્ન ક્રમ	અરજદાર શ્રી નું નામ	અરજી ની વિગત / (સેવાકીય વિનંતી)	સંબંધિત કચેરી /વિભાગ	હકારાત્મક/નકારાત્મક નિકાલ ની વિગત	રીમાર્ક્સ
૧	શ્રી વિરમભાઈ ભગાભાઈ શિયાળ ગામ : દળવી	અરજદાર ની લેસ ને ઇલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ થતાં વળતર નો બાકી રહેતો હપ્તો ચૂકવવા બાબત.	પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરી જામકંડોરણા-૨ જામકંડોરણા.	લેસ ના અકસ્માત અંગે નો બાકી રહેતા હપ્તા માટે નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક ના અહેવાલ તા. ૨૫.૦૪.૨૦૧૬ ના મળતા સક્ષમ અધિકારી ની મંજૂરી મેળવી રૂ.૧૦૦૦૦/- ચેક નં.૯૭૩૬૯૩ તા.૦૭.૦૫.૨૦૧૬ થી ચૂકવી આપેલ છે	નિકાલ
૨	શ્રી દિનેશભાઈ કરશનભાઈ રાણપરા ગામ:-જશાપર	ખેતી વિષયક વીજ જોડાણ નું નામ ટ્રાન્સફર અને લોડ ઘટાડો કરવા અંગે.	પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરી- જામકંડોરણા-૧ જામકંડોરણા.	જશાપર ગામે શ્રી કરશનભાઈ બેચરભાઈ રાણપરા ના નામ થી આવેલ ૧૦ હો.પા. ના ખેતી વિષયક વીજ જોડાણને સક્ષમ અધિકારી ની મંજૂરી થી શ્રી દિનેશભાઈ કરશનભાઈ રાણપરા ના નામે નામ ટ્રાન્સફર તા.૦૭.૦૫.૨૦૧૬ ના રોજ મંજૂર કરેલ છે.તે માટે અમારી જામકંડોરણા પેટા વિભાગીય કચેરી તરફથી પત્ર ક્રમાંક JKSD-1/TECH /Est./Rev/૨૨૨૦ તા.૦૭.૦૫.૨૦૧૬ ના નામ ટ્રાન્સફરની સિક્વોરિટી ડિપોઝિટ અને એગ્રીમેંટ અંગે નું રૂ. ૨૧૨૦/- નું ભાવ પત્રક આપેલ તે તા. ૦૯.૦૫.૨૦૧૬ના રોજ ભરપાઈ થયેલ છે અને આ વીજ કનેક્શન શ્રી દિનેશભાઈ કરશનભાઈ રાણપરા ના નામે થઈ ગયેલ છે સદર કેસ માં ફક્ત નામ ટ્રાન્સફર માટે અરજી રજીસ્ટ્રેશન થયું હતું .તે ઉપરાંત લોડ ઘટાડા સંદર્ભમાં અરજદાર દ્વારા અરજી કરેલ ન હોઈ અરજદારને લોડઘટાડા અંગે જરૂરી સમજણ આપેલ છે જે અન્વયે અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલ છે. તે અનુસંધાને તા.૧૧.૦૫.૨૦૧૬ ના રોજ ૧૦ હો.પા. માથી ૫ હો.પા. લોડ ઘટાડો મંજૂર થઈ ગયેલ છે. આમ આ પ્રશ્નનું નિરાકરણ થયેલ છે.	નિકાલ
૩	શ્રી ગિરધરભાઈ ભગવાનજીભાઈ બાલધાની ગામ:- જામકંડોરણા	વીજ કનેક્શનની ડિપોઝિટ રૂ.૫૦૦/- પરત આપવા અંગે.	પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરી- જામકંડોરણા-૧ જામકંડોરણા.	સદરહું અરજદાર દ્વારા વીજ કનેક્શન રદ કરાવ્યા બાદ ૨૪.૧.૨૦૧૪ ના રોજ પીજીવીસીએલ,જામકંડોરણા પેટા વિભાગીય કચેરીમાં અરજી કરેલ હતી. તેમાં ડિપોઝિટની રકમ ભર્યાની ઓરીજનલ રસીદ જોડેલ ન હતી. તદુપરાંત તેમણે આપેલ બોન્ડ પેપર માં પણ રસીદ ખોવાઈ ગયેલ છે તેઓ ઉલ્લેખ કરેલ છે. અને તેનો રસીદ નંબર અને તારીખ દર્શાવેલ નથી. આમ ઉપરોક્ત કિસ્સામાં ડિપોઝિટની રકમ પરત આપવા માટે જૂના દફતરી રેકોર્ડ ઉપરથી માહિતી મેળવી આજ રોજ તા.૧૧.૫.૨૦૧૬ ના રોજ રૂ. ૫૦૦/- નો ચેક નં ૯૭૩૭૪૮ અરજદારને મોકલી આપેલ છે.અને ડિપોઝિટની રકમ પરત કરેલ છે.	નિકાલ
૪	શ્રી બાબુભાઈ ડાયાભાઈ પોકીયા ગામ:-જશાપર	રહેઠાણની જગ્યા ઉપરથી ઇલેવન લાઇન ટ્રાન્સફર કરવા અંગે.	પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરી- જામકંડોરણા-૧ જામકંડોરણા.	સદર કેસમાં અરજદાર દ્વારા ૧૧ કેવી ભાદરા ખેતીવાડી ફીડરની લાઇન નીચે ગેર કાયદેસર રીતે મકાનનું બાંધકામ કરેલ છે. સદર લાઇન ફેરવવા માટે અગાઉ જસાપર ગામ પંચાયત દ્વારા તા.૧૦.૩.૨૦૧૬ ના રોજ રજૂ કરેલ. જેના અનુસંધાને નાયબ ઇજનેર ,પેટા વિભાગીય કચેરી-૧ જામકંડોરણા દ્વારા તા.૩.૫.૨૦૧૬ ના રોજ જરૂરી ચાર્જ ની રકમ ભરવા માટે જણાવવામાં આવ્યું હતું . અરજદારની રજૂઆતનાં અનુસંધાને સદર લાઇન ફેરવાવ માટેનું જરૂરી અંદાજપત્ર રૂ.૧૦૩૩૪૯/- અરજદારને નાયબ ઇજનેર, પેટા વિભાગીય કચેરી-૧ જામકંડોરણા દ્વારા પત્ર નં જેકેએસડી/ટેક/૨૨૨૫ તા.૯.૫.૨૦૧૬ ના રોજ પાઠવેલ છે. સદર અંદાજપત્રની રકમ ભરપાઈ થયા બાદ લાઇન અન્ય જગ્યાએ ફેરવવાની કામગીરી તુરંત હાથ ધરવામાં આવશે..	નિકાલ
૫	મહોબતસિંહ રવુભા ચૌહાણ	નંદન પાપડ લખેલ બોર્ડ માં પી જી વી સી એલ ની મંજૂરી વગર પાવર વાપરે છે..	પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરી- જામકંડોરણા-૧ જામકંડોરણા.	સદર જગ્યા ઉપર પી.જી.વી.સી.એલ નું કનૈયા ફૂડ પ્રોડક્ટ્સ C/O નંદન પાપડ ના નામનું ગ્રાહકનંબર -૩૯૫૦૨/૦૧૨૫૧/૮ થી ૧૯.૦ કી.વો નું ઇન્ડસ્ટ્રીયલ વીજ જોડાણ આવેલ છે.સદર કમ્પાઉન્ડ ની બહાર “નંદન પાપડ” ના નામનું લોખંડ ના પોલ ઉપર બોર્ડ લગાવેલ છે.હાલ આ બોર્ડમાં પરમેનેન્ટ ઇલેક્ટ્રીકલ વાયરિંગ નું જોડાણ જોવા મળેલ નથી આમ આ મુદ્દા નો હકારાત્મક નિકાલ થયેલ છે.	નિકાલ